

25 જુલાઈ 2018

ખરા મિત્રો મળવા અઘરા છે. આજે જ તેમના લાયસન્સ મેળવી લો!

બ્રેમ્પટન, ઓન્ટારિયો – કોઈને કલ્પના નથી હોતી કે તેમનું પાળેલું પ્રાણી ગુમ થઈ શકે - પણ ઘરમાં રાખેલી બિલાડીને બહાર નીકળી જતા ક્યા વાર લાગે છે, અથવા સરસ તાલીમ પામેલ શ્વાન પણ ગભરાઈને દોડી જઈ શકે છે. જો તેમ થાય તો તેઓ ઘરે સહીસલામત રીતે પાછા આવે તે માટેની શ્રેષ્ઠ રીત એટલે લાયસન્સ.

તેથી જ બ્રેમ્પટન એનિમલ સર્વિસિસ હવે ઘરે ઘરે જઈને બ્રેમ્પટનના એનિમલ કંટ્રોલ પેટા-કાયદા દ્વારા આવશ્યક છે તે પ્રમાણે રહેવાસીઓને પોતાની બિલાડી અને શ્વાનને લાયસન્સ કરાવવાનું મહત્ત્વ સમજાવે છે. અત્યારથી ઓગસ્ટના અંત સુધીમાં એનિમલ કંટ્રોલ ઓફિસર સમર વિદ્યાર્થીઓના નાના જૂથ સાથે મળીને માહિતીની આપણે કરશે અને લાયસન્સિંગ વિષયક પ્રશ્નોના જવાબો આપશે. તેઓ ટિકિટ્સ જારી કરશે નહીં પરંતુ જો તમે તમારું લાયસન્સ ખરીદવું ભૂલી ગયા હોવ અને તે ક્ષણે ખરીદવા માંગતા હોવ તો તેમ કરી શકશો.

દર ઉનાળે, શહેરના વિવિધ વિસ્તારોમાં વાર્ષિક ડોર-ટૂ-ડોર મુલાકાતો હાથ ધરવામાં આવતી હોય છે. આ ઉનાળે, તેમની હાજરી બોવાર્થર્ડ ડ્રાઈવ, બ્રામલિ રોડ, ક્વિન સ્ટ્રીટ અને હાઈવે 410 ખાતે કેન્દ્રિત થશે. અન્ય વિસ્તારોમાં પણ વખતે પહોંચી શકાય અને ટીમો વિવિધ પાર્ક્સમાં પોપ-અપ ડિસ્પ્લે રાખશે.

તમામ મુલાકાતો નિયમિત કામકાજના સમય દરમિયાન જ હાથ ધરાશે, સોમવારથી શુક્રવાર. ટીમ્સ સીટી દ્વારા જારી થયેલ ઓળખ પત્રો ધરાવશે અને સીટી ઓફ બ્રેમ્પટન એનિમલ સર્વિસિસ કેસ્ટ સાથેના આછા-વાદળી રંગના શર્ટ્સ પહેરશે. જો તમને કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને બ્રેમ્પટન એનિમલ સર્વિસિસનો સંપર્ક 905.458.5800 અથવા animal.services@brampton.ca પર કરશો.

લાયસન્સ લેવું કેમ અગત્યનું છે?

- જો કોઈ શ્વાન એટલેકે કૂતરો અથવા બિલાડી ખોવાઈ જાય, તો તેનું લાઈસન્સ તરત જ દેખાય છે અને દર્શાવે છે કે તે બેઘર નથી.
- પાલતુ પ્રાણીના માલિક સુધી પહોંચવાની સૌથી ઝડપી રીત એટલે લાયસન્સ. આ ખાસ કરીને ત્યારે અગત્યનું છે જ્યારે કોઈ પાલતુ પ્રાણી સાથે કારની ટક્કર થાય અથવા અન્ય કોઈ રીતે ઈજાગ્રસ્ત થાય.
- જો લાયસન્સ ધરાવતું પાલતુ પ્રાણી શેલ્ટરમાં આવે તો એનિમલ સર્વિસિસ ઝડપથી તેને ઘરે માલિકને સોંપી શકે. તે શેલ્ટરમાં ઓછો સમય વિતાવશે જેથી બન્ને, પાલતુ પ્રાણીના માલિક તેમજ પ્રાણીનો તનાવ ઓછો થઈ જશે.
- લાયસન્સ લેવાથી અન્ય પ્રાણીઓને પણ મદદ મળે છે. લાયસન્સમાંથી એકઠા થયેલ નાણા રોજ શેલ્ટરને બારણે આવતા પ્રાણીઓની કાળજી લેવામાં એનિમલ સર્વિસિસને મદદરૂપ થાય છે.



Service and Information Update